



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦



ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૬/૧૨/૨૦૧૪ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર  
શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી ૨૯૭૭/૧૪

ઓટોરીક્ષામાં બેસેલ પેસેન્જરોના થેલા/પાકીટમાંથી નજર ચુકવી દાગીના તથા રોકડ રકમ ની ચોરી કરતી ગેંગને પકડી પાડતી કાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી ની સુચના અનુસાર જે.સી.પી. શ્રી, ડી.સી.પી.શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી તથા પોલીસ ઇન્સ. શ્રી એસ.એસ.રઘુવંશીનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.જી.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી એલ.ડી.વાઘેલા તથા ટીમના માણસો સાથે મિલકત સબંધી ગુન્હા બનતા અટકાવવા તથા આવા ગુન્હા કરતા આરોપીઓ શોધી કાઢવા અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા દરમ્યાન સાથેના પો.કો.ચંદ્રકાંત જયંતીલાલ નાઓને મળેલ બાતમી આધારે ઓટોરીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી પેસેન્જરોની નજર ચુકવી તેમન થેલા/પાકીટમાંથી દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરતા (૧) રાકેશ અનિલભાઇ ઠક્કર, ઉ.વ.૩૨, રહે. આર.સી.૧૦૩, ઉમંગ ફ્લેટ ભમ્મરીયા કુવા, ને.હા.નં.૮ અસલાલી, અમદાવાદ તથા (૨) મુકેશ દુધાભાઇ રાવળ, ઉ.વ.૪૦, રહે. આર.સી. ૧૧૦, ઉમંગ ફ્લેટ ભમ્મરીયા કુવા, ને.હા.નં.૮ અસલાલી, અમદાવાદ નાઓને માણેકચોક ખાતેથી ઓટોરીક્ષા નંબર GJ-27-T-6921 સાથે પકડી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

- (૧) સોનાની બુટ્ટી જોડ સાથેનો હાર કિ.રૂ. ૨૬૬૪૦/-
- (૨) ઓમ લખેલ પેંડલ સાથી ચેઇન કિ.રૂ. ૩૧૨૨૫/-
- (૩) ઝુમ્મર ડીઝાઇન ની બુટ્ટી જોડ-૧ કિ.રૂ. ૧૩૮૮૦/-
- (૪) કાનસેર નંગ-૨ કિ.રૂ. ૧૧૧૭૫/-
- (૫) સોનાની બુટ્ટી જોડ નંગ-૧ કિ.રૂ. ૮૯૩૦/-
- (૬) જેન્ટ્સ વીંટી સોનાની નંગ-૧ કિ.રૂ. ૫૦૭૫/-
- (૭) ચાંદીની પાયલ જોડ-૧ કિ.રૂ. ૨૩૫૦/-
- (૮) લેડીસ વીંટી નંગ-૧ કિ.રૂ. ૫૬૨૦/-
- (૯) લેડીસ વીંટી ડાયમંડવાળી જેમાં નંગ લગાવેલ નથી.કિ.રૂ. ૧૮૬૧૫/-
- (૧૦) લેડીસ વીંટી ડાયમંડવાળી નંગ-૧ કિ.રૂ. ૧૦૧૧૫/-
- (૧૧) કાળા મણકાવાળી કંઠી નંગ-૧ કિ.રૂ. ૬૬૪૦/-
- (૧૨) બુટ્ટી જોડ-૧ કિ.રૂ. ૧૪૨૮૦/-
- (૧૩) કાનમાં પહેરવાની રીંગો ઝુમ્મરવાળી નંગ-૬ કિ.રૂ.૨૧૮૦૨/-
- (૧૪) મારવાડી ડીઝાઇનની સોનાની કંઠી નંગ-૧ કિ.રૂ. ૬૮૮૬૦/-
- (૧૫) ઝુમ્મર ડીઝાઇનવાળી બુટ્ટી જોડ-૧ કિ.રૂ. ૮૬૦૦/-

જે કિ.રૂ. ૨,૫૪,૭૮૭/ તથા ઓટોરીક્ષા કિ.રૂ.૮૦૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૩,૩૪,૭૮૭/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

ઉપરોક્ત બંને ઇસમો પૈકી મુકેશ દુધાભાઇ રાવળ રીક્ષા ચલાવતો હતો અને રાકેશ અનિલભાઇ ઠક્કર પેસેન્જર તરીકે પાછળ બેસતો અને અને ગીતામંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ તથા કાલુપુર રેલ્વે સ્ટેશન તથા A.M.T.S. બસ સ્ટેન્ડથી પેસેન્જર બેસાડી તેમના પાકીટ/થેલા/ લગેજ માંથી પેસેન્જરની નજર ચુકવી દાગીના તથા રોકડા રૂપિયા આરોપીઓ ચોરી કરી લેતા હતા.

ઉપરોક્ત ઇસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે ખાત્રી તપાસ પુછપરછ કરતાં આરોપીઓએ છેલ્લા ત્રણેક માસમાં ઉપરોક્ત જગ્યાએથી પેસેન્જરોને બેસાડી તેમના થેલા લગેજમાંથી ચોરીઓ કરેલ હોય જે સબંધે તપાસમાં (૧) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ફ.૮૧/૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૧૧૪ તથા (૨) કાલુપુર પોલીસ સ્ટેશન ફ.૧૩૫/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હા ડીટેક્ટ થાય છે. તેમજ આજથી દસેક દિવસ પહેલાં ગીતામંદિર એસ.ટી.બસ સ્ટેન્ડથી પેસેન્જર બેસાડી ઘોડાસર ઉતારેલ આ પેસેન્જર ના લગેજમાંથી મણકાવાળી કંઠી ચોરી કરેલ છે તથા ગીતામંદિરથી બેસાડેલ લેડીસ તથા ઉમરલાયક જેન્ટસ પેસેન્જર ને બેસાડી ભુલાભાઇ બહુચરાજી મંદિર પાસે ઉતારેલ જેમના લગેજમાંથી ત્રણ સોનાની વીંટી તથા સોનાની કાનમાં પહેરવાની રીંગો નંગ-૬ ચોરી કરેલ છે. તેમજ એકાદમાસ પહેલાં ગીતામંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ ચાર રસ્તાથી બેસાડી ૬ નંબર બસ સ્ટેન્ડ ખાતે ઉતારેલ આ ઉમરલાયક કાકા-કાકી ના લગેજમાંથી રૂ.૭૦૦૦/ રોકડા ચોરી કરેલ હોવાની આરોપીઓએ કબુલાત કરેલ છે. ઉપરોક્ત આરોપીઓ પૈકી રાકેશ અનિલભાઇ ઠક્કરનાનો અગાઉ સને ૨૦૧૩માં વટવા જી.આઇ.ડી.સી., રખીયાલ, આનંદનગર, ખોખરા પોલીસ સ્ટેશનો માં ઓટો રીક્ષાની અંદર પેસેન્જરના સ્વાંગમાં નજર ચુકવી સોના-ચાંદીના દરદાગીના તેમજ રોકડ રૂપિયા ચોરી અંગેના ગુનાઓમાં પકડાયેલ છે અને જામનગર જેલમાં પાસા અટકાયતી તરીકે રહી આવેલ છે અને ત્રણેક માસ અગાઉ જેલમાંથી છુટી ફરીથી ગુન્હા કરવા લાગેલ છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર  
પોલીસ કમિશનર વતી.